



Corporate Office: 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021

Tel.: 91 22 4353 0400 • E-mail : bluechiptex@gmail.com • Website : bluechiptexindustrieslimited.com

CIN: L17100DN1985PLC005561

Date: 3rd June, 2025

To Dept. of Corporate Services (CRD) **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001.

Scrip Code: 506981

Sub.: Submission of Newspaper Advertisement issued pursuant to the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016.

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 read with Part A of Schedule III of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith copies of newspaper advertisement published in Business Standard (English) and Western Times (Gujarati) on 3rd June, 2025, pertaining to the notice published pursuant to the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time (the Rules), for the information of the equity shareholders of the Company whose shares are due for transfer to the Demat Account of Investor Education and Protection Fund Authority under the said Rules.

Further, the aforesaid information is also available on the website Company at www.bluechiptexindustrieslimited.com.

Kindly take the above on your record and disseminate the same for information of investors.

Thanking You,

Yours Faithfully, For Blue Chip Tex Industries Limited

**BINITA** SHARAD/ GOSALIA 12:04:28 +05'30'

Digitally signed SHARAD GOSALIA Date: 2025.06.03

Binita Gosalia

Company Secretary & Compliance Officer

Membership No.: ACS 25806

Encl: as above



## **Grameen Credit Score framework** likely to be launched in 3 months

The Union government is expected to The Union government is expected to launch the Grameen Credit Score (GGS) framework within the next three months, a senior government official said. Announced by Finance Minister Nirmala Sitharaman in the Union Budget for 2052-26, the initiative is designed to strengthen financial inclusion in rural India, with a particular focus on members of self-bells groups (SHGS)

particular focus on members of self-help groups (SHGs).

"A committee has already been formed to oversee the development and implementation of the Grameen Credit Score framework. The govern-ment is currently awaiting approval from the Reserve Bank of India (RBI) before moving forward with the roll-out and is expected to go live in the next three months;" the official said.

The GGS is expected to go raye as a

next three months," the official said.
The GCS is expected to serve as a supplementary tool to existing credit bureaus, allowing banks, microfinance institutions, and other lenders to better evaluate the creditworthiness of rural borrowers.

"The current credit scoring mechanics of Credit Information Considerations of the Constant of Credit Information Consideration Constant of Constant

panies (CICs) is, by design, generic to in a written reply.



all individual borrowers with no spe-cific consideration for the rural sector. A Grameen Credit Score tailored for the credit assessment purpose of rural and SHG borrowers would facilitate better credit assessment of rural bor-

better credit assessment of rural bor-rowers, thereby improving their access to formal credit. The govern-ment is working out the modalities and the contours of the Grameen Credit Score framework in consulta-tion with the concerned stake-holders," Minister of State for Rural Development Chandra Sekhar Pem-masani had informed the Rajya Sabha in a writter reply

#### Serving credit needs

- Grameen Credit Score designed to strengthen financial inclusion in rural India
- Initiative particularly focuses on members of self-help groups
- It is expected to serve as a supplementary tool to existing credit bureaus
- Government currently awaiting RBI approval before moving forward with rollout

At present, private sector and small finance banks typically verify a borrower's credit history through agencies like CRIF Highmark and Cibli, which maintain records of past loans, repayment behaviour, and defaults, if any. A good score from these bureaus indicates that the borrower is likely to repay on time. The Grameen Credit Score holds particular importance in the context of the ongoing distribution of property cards under the Centre's Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas (SVA-MITVA) scheme, which is expected to

MITVA) scheme, which is expected to

boost credit demand in rural regions On January 18, Prime Minister Nar-endra Modi had highlighted the econ-omic potential of the initiative, stating

omic potential of the initiative, stating that once these cards are issued across all villages in the country, they could help generate economic activity worth over ₹100 trillion. "There are more than 6 lakh villages in our country. Nearly half of these villages have been surveyed by drones. After getting legal documents, lakhs of people have taken loans from banks on the basis of their houses and property," PM Modi said.

The SVAMITVA scheme is a government initiative launched in 2020 to

riment initiative launched in 2020 to provide rural residents with official ownership records of residential land. Implemented by the Ministry of Pan-chayati Raj, the scheme uses drone technology to map land parcels in over

technology to map land parcels in over 6 lakh villages, enabling the issuance of property cards. These cards serve as legal proof of ownership and help unlock the econ-omic potential of rural land by allow-ing property owners to access formal credit from banks. SVAMITVA aims to enhance transparency, reduce land disputes, and spur development in rural India. rural India.

#### India's coal production increased 2.6% in May

India produced 86.2 mil-India produced 86.2 mil-lion tonnes (mt) of coal in May, which is a 2.6 per cent increase compared to the same month last year. The growth in produc-tion and dispatch ensures

steady coal supply to

industries such as power, industries such as power, steel, and cement, the Ministry of Coal said. Higher coal production is crucial during summer months because of significant increase in electricity demand.

#### Output meter Coal production (million tonnes) LHS Power demand



#### Council of Ministers meets tomorrow, 1st after Op Sindoor

Prime Minister Narendra Modi will chair a meeting of the Union Council of Ministers on Wednesday, the first after India's punitive military action against Pakistan under Operation Sindoor launched in response to the Pahalgam terror response to the Pahalgam terror attack. According to sources, the ministers are likely to be given clealls of the operation, which is also expected to figure in the ruling Bharatity a Janata Party's programmes starting next week. Besides speaking on Operation Sindoor, the prime minister may given an overall highlight of his governance thrust in the council meeting as the ministers premare to comance thrust in the council meeting as the ministers prepare to communicate with people across the country during the anniversary events. India's precise strikes on nine terror sites in Pakistan and Pakistan-occupied Kashmir followed by its counterattack on the neighbouring country's military facilities, especially air bases, have been a highlight of Modi's recent

#### India to get remaining S-400 missiles by 2026: Russia

IIIISSINGS 07 2020. KUSSIA Russia is committed to delivering the remaining units of the S-400 air defence system to India by 2025-2026, the country's Deputy Chief of Mission in India, Roman Babushkin, said on Monday. He highlighted that the system performed "very efficiently" during the recent India-Pakistan tensions.

#### Khurshid's cryptic post on X: Is it so difficult to be patriotic?

ISTES O HIMCUIR (O DE PARTIOUE).

Congress leader Salman Khurshid, who is a part of India's diplomatic mission abroad, on Monday said it was distressing 'that people back home are calculating political allegiances and asked if it is 'so difficult to be patriotic'. Taking to X, he said, 'When on mission against terrorism, to carry India's message to the world, it's distressing that people at home are calculating political allegiances. Is it so difficult to be patriotic?"

#### Modi unlikely to attend G7 summit in Canada

For the first time in six years, Prime Minister Narendra Modi is unlikely to attend the upcoming G7 summit to be held in Canada's Alberta province, people familiar with the matter said on Monday. Canada is hosting the summit from June 15to 17th at is expected to deliberate on pressing challenges facing the globe.

#### ACCENT REGION

### CM vows to eradicate Maoist menace before March 2026 deadline

(CM) Vishnu Deo Sai.

During the campaign,
the CM visited Maoistdominated areas like
Bastar, where people demanded an end
to the Maoist menace. "It is the biggest
problem that people are facing in Bastar,
and I had assured them that they would
get rid of it at the earliest," he said. This
was a 27-day drive conducted in three
hases to assess the state overment's phases to assess the state government's performance at the grassroots level.

During the campaign, the security forces received a decisive breakthrough by eliminating the Chief and General Secretary of the Communist Party of India (Maoist), Nambala Keshava Rao alias Basavaraju alias Gaganna, on May

were related to demands raised by the people, while raised by the people, white 80,895 were about complaints," he said. Among the demands, 1 million people had urged for houses under the Prime Minister Awas Yojana. Sai said most of the demands and grievances were resolved in the camps themselves, while those left will be addressed in a time

#### LITTAR PRADESH

#### Firms push for land reforms to meet \$1 trn economy goal

VIRENDRA SINGH RAWAT

Uttar Pradesh Inc has demanded urgent industrial land reforms to help realise the state's ambitious \$x\$ trillion economy goal. With industrial-grade land being critical for setting up new factories and plants, the industry has urged the Yogi Adityanath government to expand land availability for investors.

availability for investors.

According to the Indian Industries
Association, fresh projects worth ₹6,000
crore across sectors, such as food processing, pharmaceuticals, and electronics, are
awaiting land allocation in the state.

"We have urged the UP government to
allow the conversion of leasehold industrial
land to freshold across all major industrial
development authorities," said IIA National
Vice President Detan Dea Bhalla

development authorities," said IIA National Vice President Chetan Deo Bhalla.

He noted that Uttar Pradesh State Industrial Development Authority alone has about 60,000 acres across 156 industrial areas. Converting leasehold to freehold would unlock these parcels, attract private investment, and boost state revenue through conversion fees and levies. The state's Micro, Small, and Medium Enterprises (MSME) have long demanded free. prises (MSMEs) have long demanded free-holding of leasehold plots.

#### RAJASTHAN Rising Covid cases impact state hotel bookings

#### **IOCL raises** FY26 capex target to \$4 bn

SUBHAYAN CHAKRABORTY New Delhi, 2 June

Indian oil Corporation Ltd (IOCL) on Monday said the state of the control of the

expansion projects, including the 10 million tonnes (mt) per annum capacity expansion at the Panipat refinery, and allied projects by December.

Approved in 2021, the refinery expansion in Haryana's Panipat is set to increase its is 5million metric tonnes per annum (mmtpa) capacity to 25 miltipa, at a total approved cost of \$4.5 million. Nearly \$40 per cent of the project has been completed at Panipat, which is IOCL's largest, alongside the one at Paradip in Odisha. The company's ongoing project to set up a para-yylene (PKA) and purified terephalic acid [PTA] plant at the Paradip refinery is slated to be completed by April 2026, with a total cost of \$4.5 miltinon. Nearly \$80 per cent of the work is completed.

A new pipeline carrying crude from Mundra port to the Panipat refinery is also scheduled for completion by Occember, Also on the Panipat refinery is also scheduled for completion by Occember, Also on the

scheduled for completion by December. Also on the anvil is IOCL's petrochemianvil is IOCL's petrocnemi-cal and lube integration pro-ject at the Gujarat refinery in Vadodara, expected to be completed by December. More than 80 per cent com-pleted, the project envisages raising capacity to 18 mmtpa, up from 13.7 mmtpa. currently, at a total cost of \$2.23 billion.

#### **GANESHA ECOSPHERE LIMITED**



Tel. No. 05

CORRIGENDUM to Extract of Audited Consolidated Financial Results for the Quarter and Year ended 31st March, 2025

not, 2020.

In standard the audited figures or discontinuation of the control of the audited figures or discontinuation. It is a solid that control of the c



For GANESHA ECOSPHERE LIMITEI (Shyam Sunder Sharr

#### BLUE CHIP TEX INDUSTRIES LIMITED

Registered Office: Plot No. 63-B. Danudvog S.

#### NOTICE Protection Fund (IEPF) Authority

The concerned sharefolders, holding shares in physical form and whose shares are liable to be transferred to EFF authorities to the transferred to EFF authorities as per Falles and upon such issue, the original share certificately led by them for other that the Company would be issuing new share certificately in line of the original share certificately with a property of the company of the verbale shall be deemed non-separate notice in respect of issue to the share to effect a place of the details opinionally or the company on its weeken shall be deemed non-separate notice in respect of issue of new share certificate to the details opinionally or the company of the company of the details of the company of the company

#### **RAMKRISHNA FORGINGS LIMITED**

CIN No:L74210WB1981PLC034281 Regd. Office: 23 Circus Avenue, Kolkata - 700017 one: 033-4082 0900/ 033-7122 0900, Fax: 033-4082 0998.

|     |  |   |             |   | in INR Lakhs, unle | ss otherwise stated |  |
|-----|--|---|-------------|---|--------------------|---------------------|--|
| SI. |  | Consolidated  |             |   |                    |                     |  |
| No. | Particulars                                  | Quarter - Ended Year Ended  March 31, 2025 December 31, 2024 March 31, 2024 March 31, 2025 March 31, 2024 |             |   |                    |                     |  |
|     |  | (Audited)   | (Unaudited) | (Restated)                              | (Audited)          | (Restated)          |  |
|     |  | (,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,   | (Restated)  | (************************************** | ( in animal)       | (                   |  |
| 1   | Revenue from continuing operations           | 94,721.37   | 1,07,378.18 | 97,395.63                               | 4,03,410.68        | 3,70,454.46         |  |
| 2   | Profit before tax from continuing operations | (2,364.90)  | 2,385.22    | 9,940.35                                | 14,768.71          | 39,753.35           |  |
| 3   | Profit for the year/period from continuing   |   |             |   |                    |                     |  |
|     | operations                                   | 19,983.33   | 2,090.17    | 6,528.41                                | 33,155.05          | 28,288.06           |  |
| 4   | Profit for the year/period before tax        |   |             |   |                    |                     |  |
|     | from discontinued operations                 |   |             | 111.75                                  | 9,917.78           | 1,129.81            |  |
| 5   | Profit for the year/period from              |   |             |   |                    |                     |  |
|     | discontinued operations                      |   |             | 82.88                                   | 8,347.47           | 833.21              |  |
| 6   | Profit after tax for the period              | 19,983.33   | 2,090.17    | 6,611.29                                | 41,502.52          | 29,121.27           |  |
| 7   | Total Comprehensive Income for the           |   |             |   |                    |                     |  |
|     | period / year                                | 20,331.96   | 1,924.91    | 6,170.57                                | 41,436.41          | 28,581.28           |  |
| 3   | Paid-up Equity Share Capital                 |   |             |   |                    |                     |  |
|     | (Face Value of ₹2/- per share)               | 3,620.61  | 3,616.57    | 3,615.52                                | 3,620.61           | 3,615.52            |  |
| 9   | Other Equity                                 |   |             |   | 3,00,116.56        | 2,59,772.15         |  |
|     | Earnings per equity share                    |   |             |   |                    |                     |  |
|     | (for continuing operations) (₹)              |   |             |   |                    |                     |  |
|     | (Face value per share ₹ 2/- each)            |   |             |   |                    |                     |  |
| _   | 1) Basic                                     | 11.04*  | 1.16*       | 3.61*                                   | 18.33              | 16.79               |  |
|     | 2) Diluted                                   | 11.04*  | 1.16*       | 3.61*@                                  | 18.33              | 16.65#@             |  |
|     | Earnings per equity share                    |   |             |   |                    |                     |  |
|     | (for discontinued operations) (₹)            |   |             |   |                    |                     |  |
|     | (Face value per share ₹ 2/- each)            |   |             |   |                    |                     |  |
|     | 1) Basic                                     |   |             | 0.05*                                   | 4.62               | 0.49                |  |
|     | 2) Diluted                                   |   |             | 0.05*@                                  | 4.62               | 0.49 #@             |  |
|     | Earnings per equity share                    |   |             |   |                    |                     |  |
|     | (for continuing and discontinued             |   |             |   |                    |                     |  |
|     | operations) (₹)                              |   |             |   |                    |                     |  |
|     | (Face value per share ₹ 2/- each)            |   |             |   |                    |                     |  |
|     | 1) Basic                                     | 11.04*  | 1.16*       | 3.66*                                   | 22.95              | 17.28               |  |
|     | 2) Diluted                                   | 11.04*  | 1.16*       | 3.66*@                                  | 22.95              | 17.14#@             |  |
|     | * not annualised                             |   |             |   |                    |                     |  |
|     | # after considering impact of share          |   |             |   |                    |                     |  |
|     | warrants                                     |   |             |   |                    |                     |  |
|     | @ after considering impact of                |   |             |   |                    |                     |  |
|     | amplement stock entire plan (ECOD)           | 1   | 1           | I                                       |                    | 1                   |  |

Notes:

1 The above Audited Consolidated Financial Results have been reviewed by the Audit Committee
approved by the Board of Directors of the Holding Company at their respective meeting held on May
2 Information on Audited Standalone Financial figures for the Quarter and Year ended March 31, 2022

| SI.      | Particulars                                | Quarter - Ended |                           |                | Year Ended     |                |
|----------|--|-----------------|---------------------------|----------------|----------------|----------------|
| No.      |  | March 31, 2025  | December 31, 2024         | March 31, 2024 | March 31, 2025 | March 31, 2024 |
|          |  | (Audited)       | (Unaudited)<br>(Restated) | (Restated)     | (Audited)      | (Restated)     |
| $\vdash$ |  |                 | (restates)                |                |                |                |
| 1        | Revenue from Operation                     | 80,962.28       | 96,756.48                 | 89,588.72      | 3,63,429.92    | 3,49,933.17    |
| 2        | Profit Before Tax (after exceptional item) | (1,765.86)      | 1,736.59                  | 9,034.65       | 22,356.91      | 38,451.15      |
| 3        | Profit After Tax (after exceptional item)  | 20,785.48       | 1,525.69                  | 5,776.60       | 40,182.01      | 27,404.73      |
| 4        | Total Comprehensive Income for the         |                 |                           |                |                |                |
| 1        | period [Comprising Profit for the period   |                 |                           |                |                |                |
|          | (after tax) and other Comprehensive        |                 |                           |                |                |                |
|          | Income (after tax)]                        | 21,036.78       | 1,410.79                  | 5,370.90       | 40,088.59      | 26,900.52      |

These above results is an extract of the detailed format of Audited Standalone and Consolidated Financial Resul Insea above results: a an extract of the detailed format of Audited Standardone and Consolidated Hinancial Results for the Quater and Year ended March 31, 2025 filed with the Stock Exchanges under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Standardone and Consolidated Financial Results for the Quater and Year ended March 31, 2025 are available on the company's website i.e. www.ramkristnaforignips.com and the website of BSE Limited and National Stock Exchange of finals. Limited i.e. www.beninda.com and www.nseindia.com respectively and can also be accessed by scanning the QR code given in this publication.



On behalf of the Board or Ramkrishna Forgings Limited Chaitanya Jalan ( Whole -time Director) DIN: 07540301 નડિયાદ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારોનો ભારે દેખાવો સૂત્રોચાર લેખિતમાં રજૂઆત કરી છે જેમાં

નડિયાદ નગરપાલિકામાં સન ૨૦૧૪ થી ૧૧ મહિનાના કરાર આધારિત ભરતી પામેલા ૧૮૦ સફાઈ કામદારો ની પાલિકા તંત્ર કાયમી કરે તેવી છેલ્લા ઘણા સમયથી માંગ હતી અને આ બાબતે સન ૨૦૨૨માં ઠરાવ પણ થયો હતો અને મ્યુનિસિપાલટી કમિશનરને જે તે વખતે આ કર્મચારીઓને કરારમાંથી દૂર કરીને કાયમી કર્મ્યારીની નિમણૂક બાબતની કાઈલ પણ નડિયાદ પાલિકાએ મોકલી હતી પરંતુ કેટલીક પૂર્તતા બાકી હોય આ ફાઈલ હાલમાં ત્યાં પેન્ટિંગ છે <sub>ત્</sub>યારે બીજી બાજુ મહાનગરપાલિકા બની જતા હાલમાં આવા ૧૮૦ કર્મચારીઓને આઉટ સોસિંગ તબદીલ કરવા એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેતા આવા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળે છે બે દિવસથી ૧૮૦ કર્મચારીઓ કામ બંધ કરી દેતા હાલમાં નડિયાદમાં ગંદકી દેખાઈ રહી છે તો બીજી બાજુ આવા કર્મચારીઓ કાયદાકીય લડત આપવા માટે સજ બન્યા છે

ખેડા જિલ્લા માં આવેલ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના વહીવટદારને લેખિતમાં કરેલી

(प्रतिनिधि) ભરૂચ,

ભરૂચ એલસીબીએ ઉમલ્લા

પોલીસ સ્ટેશન વિસ્તારમાં

પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હુંઢા ગામે ટેક્રા ફળીયા ખાતે રહેતો નરેન્દ્ર ઉર્ફે

નંદો પુનમ વસાવા નાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો

લાવી પોતાના ઘરના પાછળના

ભાગે આવેલ ખેતરમા સંતાડી

રાખેલ છે અને એક્ટીવા ગાડીથી

મુદામાલ સગેવગે કરવાની

જે મળેલ બાતમી આધારે ઢુંઢા ગામે ટેકરા ફળીયા ખાતે નરેન્દ્ર ઉર્ફે

નંદા વસાવાના ઘરની ખાત્રી કરી

ઘરમાં તથા આજુબાજુ તપાસ કરતા

ઘરની પાછળના ભાગે આવેલ

ખેતર માંથી ભારતીય બનાવટની

વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા ટીન બીયર નંગ ૯૫૬ કિંમત રૂપિયા ૨ લાખ પ૭ હજાર ૮૮૦

અને 'નશા મુક્ત ભારત અભિયાન'

હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે

હરિયાણાના નુહ જિલ્લાના પિંગવાન

ગામમાંથી કુખ્યાત ગાંજાના દાણચોર

જ્યારે પોલીસે દિલ્હીના કાશ્મીરી ગેટ

સ્થિત મેટકાક બસ સ્ટેન્ડ પર એક

ટકમાંથી ૫૦૦ કિલો ગાંજો જપ્ત કર્યો

હતો. આ દરમિયાન ત્રણ લોકોની

અસલમ ખાન, મૌસમ ખાન (રહે. નૂહ,

હરિયાણા) અને જકમ ખાન (રહે.

આ મામલો વર્ષ ૨૦૧૯નો છે.

જમીલ અહેમદની ધરપકડ કરી છે.

૧૮૦ કર્મચારીઓને આઉટ સોસિંગ તબદીલ કરવા એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેતા કર્મચારીઓમાં ભારે રોષ

દર્શાવ્યું છે કે હોલ મહાનગરપાલીકા

બની ત્યા સુધી આ તમામ કામદારો

પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

આ સાથે મજુર કાયદાની

જોગવાઈઓ મુજબ આ તમામ

કામદારોના ૨૪૦ દિવસ પૂર્ણ થાય

છે. અને ભારતની સર્વચ્ચ એદાલત

ધ્વારા આવા કર્મચારીઓને કાયમી

કરવા માટે ઘણા ચુકાદાઓ આપેલ છે.

જેથી હાલમા મહાનગરપાલીકા દ્વારા

આવા કર્મચારીઓને કાયમી કરી

તેઓને કાયમી મળવા પાત્ર લાભો નહી

આપવાના કારણે અને આવા કર્મચારીઓને તેઓના કાયદેસરના

મળવાપાત્ર કાયમી લાભોથી વંચીત

રાખવા માટે મહાનગરપાલીકા ધ્વારા

કોઈપણ જાતના મજુર કાયદાની

પરવાહ કર્યા વગર આવા સફાઈ

કામદારોને તેમની નોકરીઓની

શરતોમાં ફેરફાર કરી નોટીસ આપ્યા

વીના સીધા આઉટ સોર્સીંગમા

તબદીલ કર્યા છે. આ માટે એજન્સીનું

ટેન્ડર કે જાહેરાત પાડયા વીના

અલટ્રામોર્ડન એજન્સીને કોન્ટ્રકટ આપી દરેક સેનેટરીને વોર્ડ ખાતે આવી

એજન્સીના ફોર્મ મોકલાવી સફાઈ

કામદારોને તે ફોર્મ ભરવા માટે દબાણ

કરી મહાનગરપાલીકા સફાઈ

કામદારો સાથે અન્યાય કરેલ હોવાનું

જી.નર્મદા તેમજ દીનેશ શાંતીલાલ

વસાવા રહે,ચીત્રોલ તા.નાંદોદ

જી.નર્મદા વોન્ટેડ જાહેર કરી

પ્રોહીબીશન એકટ તથા ભારતીય

અહેમદને તેના ગામ પિંગવાનથી

ધરપકડ કરી. ધરપકડથી બચવા માટે.

તે મુંબઈમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ

કંપનીમાં કામ કરતો હતો અને વારંવાર

મોબાઇલ નંબર બદલતો રહેતો હતો.

જણાવ્યું કે તેણે ઓડિશાના ગેબ્રિયલ

અને પોલ નામના બે દાણચોરો પાસેથી ગાંજો ખરીદ્યો હતો. ટીમ ઓડિશાના

ગજપતિ જિલ્લાના ટિકમાલા ગામમાં

પહોંચી, જ્યાં જાણવા મળ્યું કે ગેબ્રિયલ

એક મોટો ડ્રગ સ્મગલર છે જે પહાડી

વિસ્તારોમાં ગાંજાની ખેતી કરે છે. ૧૭

કરોડ રૂપિયાના ગાંજાની ખેતીના કેસમાં

તેની વર્ષ ૨૦૨૦ માં ધરપકડ કરવામાં

આવી હતી અને તેની શોધ હજુ પણ

ગોધરામાં બકરી ઇદના

પર્વ ને લઈ ડીવાચએસપી

ઓફિસ ખાતે શાંતિ

સમિતિની બેઠક ચોજાઈ

ઈદના તહેવારને લઈને DYSP

કચેરી ગોધરા ખાતે શાંતિ સમિતિની

મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં

શહેરના રાજકીય, ધાર્મિક અને

સામાજિક આગેવાનોએ ભાગ લીધો

હતો.બેઠકમાં તહેવાર દરમિયાન

શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે

માટે વિવિધ આયોજનો અંગે ચર્ચા

કરવામાં આવી હતી. DYSP પટેલે

સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે

વિશેષ સૂચનાઓ આપી હતી. તેમણે

નાગરિકોને ઉશ્કેરણીજનક કે ધર્મને

આઘાત પહોંચાડે તેવા ફોટા અને

વીડિયો શેર ન કરવા અનુરોધ કર્યો

હતો.પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું

કે સામાજિક એકતાને નુકસાન

પહોંચાડે તેવા કોઈપણ કૃત્ય સામે

કડક કાર્યવાહી કરવામાં આવશે.

તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે

સૌ નાગરિકોને સહયોગ આપવા

અપીલ કરવામાં આવી હતી.

બેઠકમાં સમાજના તમામ વર્ગના

DYSP

ગોધરામાં આગામી બકરી

(પ્રતિનિધિ) ગોધરા.

એન.વી.પટેલની

પૂછપરછ દરમિયાન, જમીલે

રજૂઆતમાં જણાવ્યું છે કે જ્યારે નડિયાદ નગરપાલીકા હતી તે સમયે તારીખ ૨૦/૧૦/ ૨૦૨૪ ના રોજ્ ઠરાવ નંબર ૨૩ થી સફાઈ કામદારોના વારસદારોને ૧૧ મહિનાના કરાથી ૧૮૦ વ્યક્તિઓને સફાઈ કામદાર તરીકે લેવામાં આવ્યા હતા જેથી ૧૮૦ સફાઈ કામદારો નડિયાદ નગરપાલિકામાં સફાઈની કામગીરી કરતા હતા આ કર્મચારીઓ**ને** નડિયાદ મહાનગરપાલિકા આપવાની બદલે તારીખ ૧ ૬ ૨૫ થી આઉટ સોસીગ

થી તબદિલ કરવાની ઈલચાલ થઈ રહી છે તે તાત્કાલિક બંધ કરીને સરકારના ધારા ધોરણ મુજબ કાયદેસરના કર્મચારીઓને કાયમી ધોરણે નિમણૂક આપવા અમારી

બીજી બાજુ આજે ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘ દ્વારા પણ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને

ભરૂચના હુંઢા ગામેથી વિદેશી

દારૂના જથ્થાં સાથે ઈસમ ઝડપાયો

હજાર તથા મોબાઈલ નંગ ૦૧ કી.રૂ. ૫ હજર મળી કુલ કી.રૂ.૩

લાખે ૧૨ હજાર ૮૮૦ ના

मुदामाल साथे नरेन्द्र ઉई नंदो

દિલ્હીમાંથી ૫૦૦ કિલો ગાંજાની દાણચોરીનો

માસ્ટરમાઇન્ડ ૬ વર્ષ પછી પકડાચો

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ડ્રગ્સ દરમિયાન, એવું બહાર આવ્યું કે તે અને ગુપ્ત માહિતીના આધારે, ટીમે સામેના તેના ઝીરો ટોલરન્સ અભિયાન બધાને જમીલ અહેમદે ગાંજો લાવવા આખરે ૮ મે ૨૦૨૫ ના રોજ જમીલ

આવ્યું છે કે ગાંજો ઓડિશાથી ખરીદ્યો

હતો અને જમીલ આ સિન્ડિકેટનો મુખ્ય

સત્રધાર છે. તેની સામે ચાર્જશીટ દાખલ

કરવામાં આવી હતી, પરંતુ તે ફરાર રહ્યો

હતો. કોર્ટે તેના આગોતરા જામીન પણ

ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ

કેસમાં તેની કસ્ટોડિયલ પૂછપરછે જરૂરી છે જેથી સમગ્ર નેટવર્કનો ખુલાસો થઈ

વર્ષ ૨૦૨૫ માં, આ કેસની તપાસ

માટે ઓડિશા મોકલ્યા હતા.

(એજન્સી) નવીદિલ્હી, અલવર, રાજસ્થાન) ની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચના છદ્ગૃહ્ન યુનિટને

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચનાં કરવામાં આવી હતી. પૂછપુરછ સોંપવામાં આવી હતી. સતત મહેનત

પોલીસ તપાસમાં એ પણ બહાર

તથા એક્ટીવા ગાડી કિંમત રૂ.પ૦ રહે,નાના પાટણા ગામ તા.નાંદોદ

પુનમ વસાવા ઉ.વ.૨૮ રહે, ઢુંઢા, ન્યાય સંહીતાની સંલગ્ન કલમો ટેકરા ફળીયુ તા.ઝઘડિયા મુજબ ઉમલ્લા પોલીસ સ્ટેશન જી.ભરૂચ નાઓને ઝડપી પાડી બે ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં ઈસમો રણજીત મફત વસાવા આવેલ છે.

સાબર ડેરી દ્વારા ખેડબ્રહ્મામાં અમૂલ પાર્લર અને કાફેનો શુભારંભ કરાયો

લેસ્ટર્ન ટાઇસ્સ



(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે અંબાજી હાઈવે પર સાબર ડેરી દ્વારા જુના પાર્લર ની બાજુમાં જ અધ્યતન બિલ્ડીંગ બનાવી તેમાં પાર્લર તથા કાફેનું ઉદઘાટન શ્રી શામળભાઈ બી.પટેલ ચેરમેન સાબરડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક પાર્કિંગ ફેડરેશન લિમિટેડ હસ્તે તારીખ ૩૧-૫-૨૦૨૫ ને શનિવારના રોજ યોજાયું. જે પ્રસંગે શ્રી શામળભાઈ પટેલ, તથા વાઇસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈ ડી પટેલ, રામભાઈ જે પટેલ ડિરેક્ટર સાબર ડેરી, એન હતા.

એલ પટેલ એચ આર એન્ડ સિનિયર માર્કેટિંગ મેનેજર, તથા ડૉ. વિપુલભાઈ ચૌધરી, અશોકભાઈ પટેલ ડિરેક્ટર સાબર ડેરી, મણીભાઈ પટેલ ડેરી તથા અન્ય ડિરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડીસ વિભાગ વી પટેલ મેનેજિંગ ડિરેક્ટર સાબર ડેરી એન એલ પટેલ એન્ડ સિનિયર માર્કેટિંગ મેને જર તથા દો વિપુલભાઇ ચૌધરી અશોકભાઈ પટેલ ડિરેક્ટર સાબર ડેરી, મણીભાઈ પટેલ ડિરેક્ટર સાબર ડેરી તથા અન્ય ડિરેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા

ગોધરા શહેરી વિસ્તારમાં મીની બસ ચાલુ કરવા અંગે રજૂઆત

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં ફલાય ઓવર બ્રીજના બાંધકામના કારણે લાલબાગ ખાતે આવેલ બસ સ્ટેન્ડને તાજેતરમાં કામચલાઉ ધોરણે ભુરાવાવ ખાતે લઈ જવામાં આવેલ છે. જેના લીધે શહેરીજનોને બસમાં બેસવા માટે ભુરાવાવ ખાતે જવું પડે છે.ગોધરા શહેરનો ભૌગોલિક વિસ્તાર જોતાં ભુરાવાવ ખાતેનું બસ સ્ટેન્ડ પટેલવાડા,સોનીવાડ, કાછીયાવાડ,બહારપુરા, કલેકટર કચેરી,સ્ટેશન રોડ,બામરોલી રોડ, વાવડી બુજર્ગ,જાફરાબાદ,ગોન્દ્રા, સાતપુલ,પોલનબજાર,રેલ્વે સ્ટેશન વિસ્તારના રહીશો માટે ખૂબ દૂર પડનાર છે. વળી, શહેરા ભાગોળ અને કાંસુડી ખાતે રેલ્વે ગરનાળાનું કામ ચાલું હોય રેલ્વે ક્રોસીંગ પણ બંધ છે.જેના લીધે શહેરીજનોને ભુરાવાવ બસ સ્ટેન્ડ આવવા-જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવાની નોબત આવી રહી છે.જે અંગેની મને રજૂઆત મળેલ છે.ઉપરોકત પરિસ્થિતી જોતાં ગોધરા શહેરીજનોને પડનાર મુશ્કેલીના કામચલાઉ ઉકેલ માટે ગોધરા શહેરી વિસ્તારમાં સમયાંતરે મીની બસની રાઉન્ડ ટ્રીપો ચાલુ કરવામાં આવે તો તેનાથી સિનીયર સિટીઝન ઉપરાંત શાળા કોલેજના વિધાર્થીઓને ખૂબ રાહત થઈ શકે તેમ છે. આ એક સમગ્ર ગોધરા શહેરીજનોને સ્પર્શતો પ્રશ્ન હોય અને આ સુવિધા આપના કાર્યક્ષેત્રને લગતી હોય ગોધરા શહેરમાં મીની બસ ચાલુ કરવા ું ઘટતી કાર્યવાહી કરશો અને કરેલ કાર્યવાહીની મને જાણ કરશો.

## શ્રીમતી કમળાબેન પી. પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ થેરાપીનો પદવીદાન સમારંભ યોજાયો



(પ્રતિનિધિ) આણંદ, આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત અને સમગ્ર

ગુજરાતની પ્રથમ તથા એકમાત્રસેલ્ફ ઓકયુપેશનલ થેરાપી કોલેજ શ્રીમતી કમળાબેન પી. પટેલ શુકલાએ કર્યું હતું. ફોલેજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિજીઓથેરાપી એન્ડ ઓક્યુપેશનલ થેરાપીનો ૨૦૨૦ની બેચનો કોલેજપદવીદાન સમારંભ સંસ્થાના પ્રમુખ શ્રી બિપિનચંદ્ર પી. પટેલ (વકીલ)ના અધ્યક્ષ સ્થાને યોજાયો. કાર્યક્રમના

આરંભમાં કોલેજના કા. આચાર્ય

(ડો) મિનલબેન ઠક્કરએ સ્વાગત પ્રવચન સાથે અભ્યાસલક્ષી કામગીરીનો અહેવાલ રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે ફાઇનન્સ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. (ડૉ.)જાનકીબેન પદવીદાનના આ વિશેષ કાર્યક્રમમાંએપીએમએસના વાઇસ પ્રેસિડેન્ટ અને સીઇઓ ડો. પાર્થ બી. પટેલ, પ્રા. (ડૉ.) મહેશભાઈ મેઘાસંસ્થાની વિવિધ કોલેજોના આચાર્ય,સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

## ઓપરેશન સિંદુરથી પ્રેરાઇને વડોદરાના ૧૦ વર્ષના બાળકે પોતાની ચાર વર્ષની બચત સૈનિકોના કલ્યાણ માટે દાન આપી

(માહિતી) વડોદરા, છે.

આતંકવાદ સામે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર થકી કરાયેલી કાર્યવાહીથી પ્રેરાઇને વડોદરા શહેરના માત્ર ૧૦ વર્ષના એક બાળકે તેમની ચાર વર્ષની બચતની ગુલખ સૈનિકોના કલ્યાણ માટે અર્પણ કરી છે. આ બાળકની દેશભક્તિ નિહાળીને વડોદરાના કલેક્ટર ડો. અનિલ ધામેલિયા પણ

આશ્ચર્ય ચકિત રહી ગયા હતા. અહીંના અકોટા વિસ્તારમાં રહેતા અને શેર બજારના પોર્ટફોલિયો મેનેજમેન્ટનો વ્યવસાય કરતા નયન શાહ અને આનંદા શાહનો ૧૦ વર્ષનો પુત્ર અંશ શાહ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. અંશની આયુ ભલે નાની હોય પણ ભગવાને તેમને હદય દરિયા જેવું વિશાળ આપ્યું છે.

અંશની દૅરિયાદિલી એટલી છે કે, તે પોતાના જૂના પુસ્તકો, વસ્ત્રો સહિતની વસ્તુ સમયાંતરે દાન કરતો રહે છે. તેમની દાનવૃત્તિ પણ ગજબ છે. તેમના માતાપિતા તેમના આવા સદકાર્યો માટે પ્રેરણા આપતા રહે છે અને સખાવતી સદ્દગુણને પોષતા રહે

તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકી હમલા અને તે બાદ તેનો જવાબ આપવા ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર થકી કરાયેલી કાર્યવાહીની વિગતો અંશને સમાચાર માધ્યમોથી મળી અને તેમાં તીવ્ર દેશભક્તિ જાગૃત થઇ ઉઠી. હું આપણા આવા વીર સૈનિકો માટે શું કરી શકું ? એવો પ્રશ્ન તેમણે પોતાના માતાપિતાને પૂછ્યો. સવાલ સાંભળી નયનભાઇ અને આનંદાબેન પણ ચોકી ઉઠ્યા. માતાપિતાએ કહ્યું કે, તારી ગુલખ સૈનિકોના કલ્યાં માટે દાનમાં આપીએ ! આ સાંભળી અંશ રાજી થઇ ગયો. અંશ છેલ્લા ચારેક વર્ષથી બચત કરે છે અને તે રકમ ગુલખમાં જમા કરે છે. આ ચાર વર્ષની તેમની બચત લઇ માતા સાથે સવારે વડોદરા કલેક્ટર ઓફિસે પહોંચી ગયો અને ગુલખ તોડ્યા વિના એમ ને એમ જ, કલેક્ટરે ડો. અનિલ ધામેલિયાને દાનમાં આપી દીધી. કલેક્ટરશ્રીએ પણ આ ૧૦ વર્ષના બાળકની દેશભક્તિને બિરદાવીને એક પુસ્તક ભેટ આપ્યું હતું.

#### NATRAJ EDUCATION AND CHARITABLE TRUST-UNA VIJAY INSTITUTE OF TECHNOLOGY Una-Veraval Bypass, Nr. Lmadhar Patiya, Una- 362560, Contact- 7265999383 Recruitment of Teaching Staff. Application are Invited For Following Posts. COURSES / SUBJECT/POST LECTURER HOD 1 Diploma In Computer Engineering 2 Diploma In Mechanical Engineering Diploma In Electronics & Communication 2 1 4 Diploma In Information Technology 1 5 Diploma In Cyber System & Information Security 6 Principal-1 Application / Resume Can be Sent on our email- nect383@gmail.com with all necessary Certificate, documents and Passport Size Photograp

Qualification & Pay Scale: As Per The Norms of AICTE, Govt. fo Gujara

& GTU Higher qualification and exp. can be considered for higher salary.

## અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોચલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાશે



અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની બેંગ્લોર અને પંજાબ વચ્ચે કાઈનલ મેચ રમાશે ઉપરોક્ત તસવીરમાં બબ્ને ટીમોના કેપ્ટનો ટ્રોફી સાથે નજરે પડે છે.( તસ્વીર:- જયેશ મોદી

વરસાદની ૬૪ ટકા શક્યતા છે. આ

સમય દરમિયાન, વાદળછાયું

વાતાવરણ રહેશે અને પવન પણ

લગભગ ૧૭ કિલોમીટર પ્રતિ

કલાકની ઝડપે ફૂંકાશે. તો લઘુત્તમ

તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ અને

મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી

સેલ્સિયસ સુધી વધવાની ધારણા છે.

AccuWeather ના મતે આ

વરસાદ સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ

રહેશે અને તે પછી હવામાન સ્વચ્છ

રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં

ટોસ અને મેચ શરૂ થવામાં વિલંબ

થઈ શકે છે. તો હવામાન વિભાગ

દ્વારા પણ અમદાવાદમાં હળવાથી

મધ્યમ વરસાદની આગાહી

विभागे रविवारे पंजाध डिंग्स

અમદાવાદમાં હવામાન

(એજન્સી) નવી દિલ્હી, આઈપીએલ-૨૦૨૫ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સિઝનની છેલ્લી અને ટાઇટલ મેચ ૩ જૂન, મંગળવારના રોજ રોયલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમો ફાઇનલ જીતીને પોતાનો પહેલો ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે, જ્યાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડिયન્સની ક્વોલિફાયર ર વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને મેચ લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. શું વરસાદ મંગળવારે આઈપીએલની ફાઇનલમાં વિક્ષેપ પાડી શકે છે ? ત્યારે એ જાણી લઈએ કે ૩ જૂને અમદાવાદમાં હવામાન કેવું રહેંશે ? અને જો મેચ રદ થાય છે, તો

અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં વરસાદની શક્ચતા માત્ર ર ટકા હતી, પરંતુ વરસાદ આનાથી ઘણો વધારે હતો અને મેચ લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં મંગળવારે અમદાવાદમાં અમદાવાદનું હવામાન ક્ચારે કરવામાં આવશે.

કરવામાં આવી છે.

બદલાશે તે કહી શકાય નહીં. જોકે, ફાઇનલના દિવસે વરસાદની શક્ચતા ૬૪ ટકા છે. જો હવામાન બદલાય છે, તો મેચ ધોવાઈ શકે છે.

જો વરસાદને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચ રદ થાય છે અથવા શરૂ થતી નથી, તો આઈપીએલની ફાઇનલ માટે એક વધારાનો દિવસ એટલે કે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો ફાઇનલ ૩ જૂને ના યોજાય, તો તે બીજા દિવસે ૪ જૂને યોજાઈ શકે છે. બાકીની આઈપીએલની મેચો માટે આવી કોઈ વ્યવસ્થા નહોતી, પરંતુ આ ટાઇટલ ટક્કર હોવાથી મેચ યોજવા અને તેને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. પરંતુ રિઝર્વ ડેના દિવસે પણ જો મેંચ કોઈ કારણોસર ના રમાઈ શકે તો જે ટીમ પોઈન્ટ ટેબલમાં આગળ હતી તેને ચેમ્પિયન જાહેર

# ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે રસ્તો કાઢવાની અદાવતે મારામારી

ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતા મુકેશભાઈ રમણભાઈ ડામોરે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા ૩૧ મેના રોજ સાંજના સમયે રસ્તો કાઢવાની

કઈ ટીમ વિજેતા બનશે ?

તેના હાથમાં રહેલી લાકડી મુકેશભાઇના પિતા રમણભાઈને ખભાના ભાગે તેમજ બરડાના ભાગે મારી દીધી હતી. તેમજ નકુલભાઈ બળવંતસિંહ બારિયાએ તેના હાથમાં રહેલું ધારિયાની પૂંઠ સાજનભાઈને મોઢાના ભાગે

રાહુલભાઈ જાલમસિંહ બારીયાએ

હતી.જ્યારે પૃથ્વીરાજ બળવંતસિંહ બારિયા અને ચેતનભાઈ પૃથ્વીરાજ બારીયા નામના ઈસમોએ હાથમાં છૂટા પથ્થરો મારતા મુકેશભાઈને મોથાના પાછળના ભાગે ઇજા થઈ હતી.જે બાદ ચારેય ઈસમોએ ભેગા મળીને રમણભાઈને જણાવ્યં હતું કે અમે અહીંયાથી જ રસ્તો કાઢીશું.

## અદાવતે ઝઘડો થયો હતો.જેમાં મારીને ઈજાઓ પહોંચાડી

ficici Bank કોર્પોરેટ ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેંક ટાવર, ચકલી સકલ પાસે, જૂના પાદરા રોડ, વડોદરા-૩૯૦ ૦૦૭ કોર્પોરેટ ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેન્ક ટાવર્સ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ૪૦૦૦૫૧

ગોલ્ડ ઇ-હરાજી ક્રમ આમંત્રણ સૂચના ગાલ્ડ ઇ-હરાજી કમ આમંત્રણ સૂચના નીચે જણાવેલા ઋણ લેનારાઓને સોનાના દાગીના સામેની સુધા મેતની બાકી રકમ ચૂકવવા નીટિસ આપવામાં આવી છે. ('સુવિયા') તેઓ આઇસીઆઈસીઆઈ બેંક લિમિટેડ ('આઈસીઆઈસીઆઈ ) પાસેથી મેળવે છે. અમે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ ગીરવે મુટેલા સોનાના ઘટેલાની ઇ-ઓક્ટના ૧૩ના મજબૂર છીએ કારણ કે તેઓ બાહી ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા છે. આઈસીઆઈસીઆઈ બેંક પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના ખાતું બંધ કરવાની/ઇ-ઓક્ટનની તારીખ બદલવાની સત્તા છે. ઓનલાઈન હરાજી https://jewel-auction.procuretiger.com બપોરે ૧૨:૩૦ થી ૩:૩૦ વચ્ચે યોજાશે. વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને આપેલ વેબસાઇટ પર લોગ ઈન કરો. ઉધાર લેનારનું જો મૃત્યુ વર્ષ હોય તો દેશમાંતાં, તામા શરતો કાનની વાનદારોને લાગ પાઇ તે

| 072662004475<br>शाणाल् ना<br>085262002778<br>शाणाल<br>017962007006 | ાર્ક્સઝ વલાવાન 8 ઉપજ<br>મઃ સુરત-પીપલીદ<br>નિલેશ શાંતારામ બોમ્બલે<br>નામઃ વાપી | 74156200081<br>थाजालू लाम:<br>170162008071 | ામ: સરત-કપરાકા<br>સિર્ધશ્વરપ્રાસા ડી લાખુપ્રસાદ ગુર<br>લલિયા અબકારા |  |  |
|--|---|--|---|--|--|
| 072662004475<br>शाणाल् ना<br>085262002778<br>शाणाल<br>017962007006 | ફિરોઝ વલીમામદ ઉધેજા<br>મઃ સુરત-યોપલોદ<br>નિલેશ શાંતારામ બોમ્બલે<br>નામઃ વાપી  | शामार्बु नामः<br>170162008071              | નલિયા અલકાસા  |  |  |
| 085262002778<br>शामा<br>017962007006                               | નિલેશ શાંતારામ બોમ્બલે<br>અમઃ વાપી  | 170162008071                               |   |  |  |
| 085262002778<br>शामा<br>017962007006                               | નિલેશ શાંતારામ બોમ્બલે<br>અમઃ વાપી  |  |   |  |  |
| 017962007006   |   |  | પઢિયાર અનવર ઉર્સ  |  |  |
| 17962007006  |   |  | રા-ભાચલી કેનાલ રોડ  |  |  |
| amar I ama   | રાકેશ જેશરાજ અસોપા  | 447557000006                               | પ્રિયાલ જનક કટકીયા  |  |  |
|  | વડોદરા-નિઝામપુરા  | शाभान्                                     | નામઃ ઈંડર   |  |  |
| शाणानु नामः<br>DB5462002202  |   | 171962006904                               | નરેશભાઈ ચેનવા   |  |  |
| 985462002202   | સમીર અરવિંદભાઈ ત્રિવેદી   | શાખાનું નામ:                               | સુરત-અઠવાલાઈન્સ   |  |  |
| શાખાનું ન  | ામઃ બારડોલી   | 005257000326                               | લાખાની અનવરઅલી હસનઅલી   |  |  |
| 45962009453  | સતીષભાઈ સુછલ  | શાખાનું ના                                 | મઃ સુરત-ઉદ્યના  |  |  |
| 45962010104  | સતીષભાઈ સુછલ  | 138562005101                               | . વનીષા યશ  |  |  |
|  | સતાવભાઇ સુછવ  | शाभानु                                     | ाभः ओलपाऽ   |  |  |
| 45962010133  | સતીષભાઈ સુછલ  | 758262001802                               | ખલાસા આશિષભાઇ ઉત્તમભાઇ  |  |  |
| शाजानुं नामः मारवी-नेशनस टर्ज                                      |   | શાખાનું નામઃ ઝાડેશ્વર                      |   |  |  |
| 49862001388  | ભાવિનકુમાર રમેશભાઈ માલવિયા  | 180062001862                               | લાડુકુમાર સંજય પીઠાભાઈ  |  |  |
|  |   |  | ામઃ બારડોલી   |  |  |
|  | રૂજ-આત્મારામ સર્કલ  | 045962009005                               | સતીષભાઈ સુછલ  |  |  |
| 348762000630   | મિતેષ ડી ડાંગર  | 399962002911 અભેગી સ્ત્રીકલાઈ              |   |  |  |
| શાખાનું નામઃ   | વલસાડ-હાલાર રોડ   |  |   |  |  |
| 006862005677   | મિતાંગ મોતીભાઈ શાહ  |  | સુરત-સિટીલાઇટ   |  |  |
| sunu ( unu   | વલસાક-અભામા   | 085162003234                               | ડાલાવ્હેરા સિપુ બાબુલાલભાદ  |  |  |
| 261357000010   | મિતાંગ મોતીભાઈ શાહ  | શાખાનું નામ:                               | અમદાવાદ-મોટેરા  |  |  |
| Sinalai  | नामः सायन   | 324557000001                               | વિકાસ ચંદ્રા  |  |  |
| 281262003086   | હિરેનભાઈ દિનેશભાઈ પટેલ  | શાખાનું                                    | लामः धर्धेऽ।  |  |  |
| LOILOLOGGOGG   | ાહરનભાઇ ાદનેશભાઇ પટેલ   | 757357000030                               | અનિલ સિંઘ   |  |  |
| શાખાનું નામઃ જામનગર-ખોડિયાર કોલોની                                 |   | शाणानुं ना                                 | મઃ સુરત-સરશાણા  |  |  |
|  |   | 348062001673                               | સિધ્ધાપરા જીગર હિંમતભાઈ   |  |  |
| 072662003210   | અમિતકુમાર દીક્ષિત<br>અમિતકુમાર દીક્ષિત  | शाजान ना                                   | મઃ સુરત-પીપલીદ  |  |  |
| 072662004321   |   | 085262003045                               |   |  |  |
| O, LOOLOO-SLI  | રાજકોટ-લક્ષ્મીનગેર  |  | લવીશ સી તિવારી  |  |  |

જમનગર, અમદાવાદ, વલસાડ, કચ્છ, મોરબી, વડોદરા, સુરત, બોટાદ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા, નવસારી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, મહિસાગર

**ા** મુંબઇ

**તારીખ**ઃ ૩ેજી જૂન, ૨૦૨૫

શાખાનું નામઃ ભૂજ 2005998 ભાનુશાલી સુનીલભાઇ બાબુભાઇ ક લુશાવાડા ડામોર પંકજકુમાર કઃ બારડાલા રબારી દિવ્યાંગભાઈ નાટુભાઈ મેર સંજયભાઈ જીવરાજભાઈ શાખાનું નામઃ સુરત- કોસાડ સંતોષ હરીકાંત સાવલે in: બાર્ષેદ રૂપેશ ચૈતન્યકુમાર પટેલ રૂપેશ ચૈતન્યકુમાર પટેલ

સહી/- અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ વતી

## બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

CIN: L17100DN1985PLC005561 ૨જી ઓફિસ: પ્લોટ નં.૬૩-બી, દાનુયુગ સહકારી સંઘ લી. ગામ પીપરીયા, સીલવાસા, દાદરા અને નગર હવેલી-૩૯૬૨૩૦, ક્રમેકલ: bluechiptex@gmail.com, વેબસાઇટ www.bluechiptexindustrieslimited.com દેલીફોન નં. +૯૧ ૯૯૦૪૦ ૧૧૫૫૩/+ ૯૧ ૨૨ ૪૩૫૩ ૦૪૦૦ नोटिस

### ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF) ઓથોરિટીના ડીમેટ ખાતામાં ઇક્વિટી શેર ટ્રાન્સફર કરવાની સૂચના

આથી સૂચના આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૨૪ (૬) ની જોગવાઈઓને એનુરૂપ, રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ સત્તાધિકાર (એકાઇન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સકર અને રિકંડ) નિયમો, ૨૦૧૬ સાથે વાંચવામાં આવે છે, જે સમયાંતરે સુધારેલ છે ( "નિયમો"), કંપનીના ઇક્વિટી શેર કે જેના સંદર્ભમાં બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ("કંપની") ના શેરધારકો દ્વારા છેલ્લા સળંગ સાત સમયગાળા માટે ડિવિડન્ડ (ઓ) રોકડ કરવામાં આવ્યા નથી અથવા દાવો કરવામાં આવ્યો નથી (૭) વર્ષ કે તેથી વધુે, કંપની દ્વારા કાયદેસર રીતે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત IEPF ઓથોરિટીના ડીમેંટ ખાતામાં ટ્રાન્સફર કરવાની જરૂર છે. ચોક્કસ શેરધારકોના નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટેના ડિવિડન્ડથી માંડીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધીના સળંગ સાત (૭) વર્ષ માટે દાવો ન કરાયેલ/ અનચુકવેલ ડિવિડન્ડ હાલમાં કંપની પાસે પડેલું છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે દાવો ન કરાયેલ/અનચુકવેલ ડિવિડન્ડ ૧૦મી ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં

તદુર્વુસાર અને નિયમોમાં નિર્ધારિત વિવિધ આવશ્યકતાઓનું પાલન કરીને, સંબંધિત શેરધારકોને તેમના નવીનતમ ઉપલબ્ધ સરનામાં પર વ્યક્તિગત સંદેશાવ્યવહાર મોકલવામાં આવે છે જેમના શેર યોગ્ય પગલાં લેવા માટે ઉપરોક્ત નિયમો અનુસાર IEPF ઓથોરિટીના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા જરૂરી છે. જો કંપનીને ૧૦મી ઓક્ટોબર, ૨૦૨૫ સુધીમાં સંબંધિત શેરધારકો તરફથી કોઈ સંદેશાવ્યવહાર પ્રાપ્ત ન થાય, તો કંપની, નિયમોમાં નિર્ધારિત જરૂરિયાતોનું પાલન કરવાના હેતુથી, બાકીના સમય સુધીમાં IEPF ઓથોરિટીના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સકર કરશે. નિયમોમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ તારીખ. વધુમાં, કંપનીએ તેની વેબસાઇટ www.bluechiptexindustrieslimited.com પર IEPF ઓથોરિટીના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સકર કરવાના બાકી હોય તેવા શેરોની વિગતો સાથે આવા શેરધારકોની સંપૂર્ણ વિગતો અપલોડ કરી છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના અન-કેશ્ડ ડિવિડન્ડ(ઓ) અને IEPF ઓથોરિટીના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર હોય તેવા શેરની વિગતો ચકાસવા માટે કંપનીની ઉપરોક્ત વેબસાઇટનો સંદર્ભ લો.

સંબંધિત શેરધારકો, જેઓ ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવે છે અને જેમના શેર IEPF સત્તાવાળાઓને ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે, તેઓ નોંધ કરી શકે છે કે કંપની તેમના દ્વારા રાખવામાં આવેલા અસલે શેર પ્રમાણપત્ર(ઓ)ને બદલે નવા શેર પ્રમાણપત્રો જારી કરશે. નિયમો અનુસાર IEPF સત્તાર્વાળાઓને શેર ટ્રાન્સફર કરવાનો હેતુ અને આવા મુદ્દા પર, તેમના નામે નોંધાયેલ અસલ શેર પ્રમાણપત્ર(ઓ) આપમેળે રદ થઈ જશે અને બિન-વાટાઘાટપાત્ર માનવામાં આવશે. શેરધારકો વધુમાં નોંધ કરી શકે છે કે કેંપની દ્વારા તેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતોને નિયમો અનુસાર IEPF સત્તાવાળાઓને શેર ટ્રાન્સફર કરવાના હેતુથી કંપની દ્વારા નવા શેર પ્રમાણપત્ર(ઓ) જારી કરવાના સંદર્ભમાં પર્યાપ્ત સૂચના માનવામાં આવશે.

આવા શેરો પરનું કોઈપણ વધુ ડિવિડન્ડ IEPFમાં જમા કરવામાં આવશે અને દાવો ન કરાયેલ/અનચુકવેલા ડિવિડન્ડ અને/અથવા IEPFને ટ્રાન્સકર કરાયેલા શેરના સંદર્ભમાં કંપની સામે કોઈ દાવો કરવામાં આવશે નહીં. ડિવિડન્ડ અને શેર IEPFને ટ્રાન્સકર કરવા પર, શેરધારકો નિયમોમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ IEPF પ ફોર્મમાં IEPFને અરજી કરીને તેનો દાવો કરી શકે છે. આ ફોમ IEPFની વેબસાઇટ ે www.iepf.gov.in. પર ઉપલબ્ધ છે. જો શેરધારકોને વિષય અને નિયમો અંગે કોઈ પ્રશ્નો હોય, તો તેઓ કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ ("આરટીએ") અથવા કંપનીનો નીચે જણાવેલ

સરનામે સંપર્ક કરી શકે છેઃ વ. **બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (આરટીએ)**, ઓફિસ નં.એસ૬-૨, છક્કો માળ, પિનેકલ બિઝનેસ પાર્ક, આહુરા સેન્ટરની બાજુમાં, મહાકાલી ગુફાઓ રોડ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૯૩, **ઇમેલ આઇડી**:investor@bigshareonline.com, **ટેલિફોન નંબર**: ૯૧ ૨૨ ૬૨૬૩ ૮૨૦૦, <del>ફેક્સ નંબર</del>ઃ ૯૧૨૨ દરદઉ ૮૨૯૯.

**૨. ૦લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઓફિસ** નંબર-૧૫-૧૭, પહેલો માળ, મેકર ચેમ્બર્સ-૩, જમનાલાલ બજાજ રોડ, નરીમાન પોઈન્ટ, મુંબઈ 🗕 ૪૦૦ ૦૨૧, **ઇમેલ આઇડીઃ** bluechiptex@gmail.com, **ટેલિ. નંબરઃ** ૯૧ ૨૨ ૪૩૫૩ ૦૪૦૦ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી

**૦લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ** વતી

શ્રી.બીનીતા ગોસાલીય हांग्ली अहें २३ अन्ते हमायाशस्त्र अमेहिअइ

## ગોધરા : રહેણાંક મકાનમાં માંસનું વેચાણ કરતો ઈસમ ઝડપાથો

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગેની પ્લૉટ વિસ્તારમાં આવેલ ટેકરો ટાવરની સામે આવેલા એક રહેણાંક મકાનમાં શંકાસ્પદ માંસનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે.જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તા ૧ જૂનના રોજ બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો. પોલીસે મકાનમાં માંસનું વેચાણ કરતા જુબેર અહેમદ બૂમલા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.જ્યારે રહેણાંક મકાનમાંથી રૂ.૧૭,૮૦૦ ની કિંમતનો ૮૯ કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માંસનો જથ્થો તેમજ અન્ય સાધનો મળીને કુલ રૂ.૨૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

### રહ3 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ખેડા જિલ્લામાં પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહીં

પહેલા દિવસે સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવા મોટે લોકો કામે લાગે છે પુરંતુ આ વખતે એક પણ ઉમેદવારોએ પહેલા દિવસે ઉમેદવારી નોંધાવી નથી.

ખેડા જિલ્લાની ૯૧ ગામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને ૧૮૨ ગ્રામ પંચાયતની પૈટા ચૂંટણી મળી કુલ ૨૭૩ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આજે આ ગામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો જો કે આજે કોઈએ ઉમેદવારી ના નોંધાવતા પંચાયતની ચૂંટણીમાં ખાતું ખુલ્યું નથી જોકે ઓવતીકાલે ઉર્મેદવારી પત્ર ભરાય તેવી શક્ચતા છે.

ખેડા જિલ્લાની ૯૧ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૮૨ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી આગામી રર્ જુનના રોજ યોજાવાની છે. આ તમામ જોવા મળી રહી છે. સરપંચ બનવા

(પ્રતિનિધિ) નડિયાદ, ઇચ્છુક ઉમેદવારો કાવદાવાના પેચ લડાવી રહ્યા છે. તંત્ર દ્વારા ગતરોજ ચૂંટણીની જાહેરાત થતાંની સાથે આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે?.જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જેમાં આ તમામ ગ્રામ પંચાયતોમાં ૧૦૩ સરપંચોની બેઠક છે. ૧૧૧૦ વોર્ડ સભ્ય સંખ્યા છે. પર૪ મતદાન મથકો, ૭૮૬ મતપેટીઓનો ઉપયોગ થનાર છે. આ સાથે ૩૮ ચૂંટણી અધિકારી, ૩૮ મદદનીશ ચૂંટણી અધિકારી, ૨૮૭૫ પોર્લિંગ સ્ટાફ, ૭૮૧ પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહેશે. આ તમામ ગ્રામ પંચાયતોમાં કુલ ૪,૦૬૧૮૨ મતદારો ભાઈ-બહેનો નોધાયેલા છે. જેમાં ૧,૯૯,૮૦૩ સ્ત્રી મતદારો અને ૨,૦૬૩૭૯ પુરૂષ મતદારો છે.

ઉमेदवारी पत्र (भरवानो पथम દિવસ હતો પરંતુ ૧૮૨ ગ્રામ પંચાયતમાંથી કોઈ ગામ પંચાયતમાં ગામડાઓમાં રાજકીય ચહલપહલ એક પણ ઉમેદવારી પત્ર ભરાયું

આજે આ ચૂંટણી માટે નિર્ણય લેવો.

લોકોની હાજરી નોંધપાત્ર રહી હતી. **વ્યક્ટનું કાઇક્સ** વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી

-જાહેરખબર મેનેજર